



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન

મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફિસ,
સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧

જાહેરખબર ક્રમાંક : ૦૪/૨૦૧૭-૧૮



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. ખાતા માટે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન(NULM) યોજનાના અમલીકરણ અર્થે કરાર આધારીત નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી આસી.મેનેજર(ઇન્ટરવ્યુ બ્રાન્ચ), મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફિસ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૦૧ને તા.૦૧/૦૮/૨૦૧૭ના રોજ સાંજના ૦૫:૩૦ કલાક સુધીમાં મળે તે રીતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ / સંખ્યા	શૈક્ષણિક લાયકાત અને અનુભવ
સમાજસંગઠક (કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર) - ૨૫	ઘોરણ - ૧૨ પાસ અને સમાજલક્ષી સેવાઓનો ૫(પાંચ) વર્ષનો અનુભવ અથવા માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડીગ્રી અને સમાજલક્ષી સેવાઓનો ૨(બે) વર્ષના અનુભવની લાયકાત ધરાવતા હોવા જોઇએ.
કરાર આધારિત માસિક ફીક્સ મહેનતાણું રૂ. ૧૦,૦૦૦/-	
વયમર્યાદા મહત્તમ ૩૫ વર્ષ, સુવર્ણજયંતિ શહેરી યોજના અંતર્ગત અગાઉના કરાર આધારિત સમાજસંગઠકોને વયમર્યાદામાં મહત્તમ ૫(પાંચ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.	

-: ઉક્ત જગ્યા માટે નિયત ફોર્મમાં અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની લાગુ પડતી અગત્યની સુચનાઓ :-

૧. સદરહુ જગ્યા માટે નિયત ફોર્મમાં અરજી કરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ અરજદારે સ્વહસ્તાક્ષરમાં જરૂરી વિગતો ભરી તમામ પ્રમાણપત્રો સાથે અરજી પત્રક નિયત સમયમર્યાદામાં ઉપરોક્ત જણાવેલ સરનામે રૂબરૂ/રજી.એ.ડી.પોસ્ટ/સ્પીડપોસ્ટ/કુરીયરથી મોકલી આપવાનું રહેશે.
૨. ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઉંમર અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો ફરજિયાતપણે સામેલ કરવાની રહેશે.
 - A. શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે જાહેરાતમાં નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ તમામ વર્ષની માર્કશીટ, એટેમ્પ્ટ સર્ટી(ટ્રાયલ સર્ટી) તેમજ ડીગ્રી સર્ટી અચૂકપણે સામેલ કરવાના રહેશે. માર્કશીટ, ડીગ્રી સર્ટીફિકેટમાં ટકાવારીના બદલે ગ્રેડ, સી.પી.આઇ. કે સી.જી.પી.એ. દર્શાવેલ હોય તો તેનું ઉમેદવારે સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે.
 - B. જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત/ડીગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ ધ્યાને લેવામાં આવશે. તે પહેલાનો અનુભવ કોઇપણ સંજોગોમાં માન્ય ગણાશે નહિ.
 - C. અનુભવના પુરાવા તરીકે અરજદારે જે તે માન્ય સંસ્થાનું ઇન્વર્ડ/આઉટવર્ડ નંબર તથા તારીખ સહીતનું જાહેરખબરમાં નિર્દેશ કર્યા મુજબની વિગતોવાળું જ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર પુરાવા તરીકે અમાન્ય ગણાશે. પરંતુ જો તેની સાથે વખતોવખત સંસ્થા દ્વારા અપાયેલ

- ઇજાજા કે પ્રમોશનના હુકમો, પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવાઓ સામેલ કરેલ હશે, તો તેની પુરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયેથી તેવો અનુભવ માન્ય ગણવામાં આવશે.
- D. ઉંમરના પુરાવા તરીકે સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ/જન્મ તારીખનું પ્રમાણપત્ર ફરજિયાત પણે સામેલ કરવાનું રહેશે.
૩. તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત અને અનુભવ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.
 ૪. મહિલા ઉમેદવાર જો તેમના પિતાને બદલે પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેમણે લગ્ન રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ અરજી પત્રક સાથે ફરજિયાતપણે સામેલ કરવાની રહેશે.
 ૫. અધૂરી વિગતોવાળી, નિયત ફોર્મમાં ન હોય તેવી, અધૂરા પ્રમાણપત્રોવાળી, છેલ્લી તારીખ બાદ મળેલ અરજીઓ અમાન્ય ગણાશે. તેમજ સ્વીકારવાની છેલ્લી તારીખ બાદ મોકલેલ પ્રમાણપત્રો અમાન્ય ગણાશે.
 ૬. અરજી પત્રકમાં દર્શાવેલ વિગતોમાં પાછળથી કોઇપણ સંજોગોમાં ફેરફાર કરવા દેવામાં આવશે નહીં.
 ૭. ઉમેદવારોએ લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે આવવાનું રહેશે.
 ૮. પસંદગીના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી/મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી/મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
 ૯. પસંદગી પામેલ ઉમેદવારની નિમણુંક સત્તાધારી ઠરાવે તે શરતોને આધિન રહેશે.
 ૧૦. ઉમેદવારે અરજીમાં કોઇપણ વિગત ખોટી દર્શાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયાના કોઇપણ તબક્કે ખોટી માલૂમ પડશે તો તેમની અરજી જે તે તબક્કે રદ કરવામાં આવશે તથા તેણે લાયકીઘોરણ (Passing Standard) મેળવેલ હશે તો પણ તેમની ઉમેદવારી રદ ગણાશે. તેમજ ભવિષ્યમાં પણ ઉમેદવારે નિમણુંક સમયે રજૂ કરેલ જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વય, અનુભવ અને અન્ય પુરાવા ખોટા માલૂમ પડશે કે શંકાસ્પદ જણાશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા ઉમેદવારની પસંદગીથી નિમણુંક થયેલ હશે તો કોઇપણ તબક્કે નિમણુંક રદ કરવામાં આવશે.
 ૧૧. સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની ગેરલાયકાતમાં પરિણમશે.
 ૧૨. આપેલ જાહેરખબર કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેવા સંજોગોમાં તેમ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
 ૧૩. ફીક્સ મહેનતાણું - કરાર આધારિત નિમણુંક પામનાર ઉમેદવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલ બોલીઓ અને શરતોને આધિન કરાર/બોન્ડ કરવાનો રહેશે

તા. ૧૮/૦૭/૨૦૧૭

સહી/-
મ્યુનિસિપલ કમિશનર